



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૦૬/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૬૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૪ કેસ કરી, ૯૩ વ્યક્તિઓને ઝડપી, ૫૨૨ લીટર દેશી દારૂ, ૩૧૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૯૫ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧૭૩ બિયર ટીન, ૧ સ્કુટર, ૨ મોટર સાયકલ અને ૨ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૯ કેસ કરી ૪૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૨,૯૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૬૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૬૭/૧૯

ગોમતીપુર: નરેંદ્ર રજનીકાંત ઝા (રહે.અન્નપુર્ણા સોસાયટી અનીલ સ્ટાર્ચ રોડ બાપુનગર) એ તા.૦૫/૦૬/૧૯ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૨/૨૦૧૪ થી તા.૨૮/૧૧/૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન ગોમતીપુર રખિયાલ રોડ મેથોડીક ચર્ચની બાજુમા શેઠ સી.એલ હિંદી હાઇસ્કુલ ખાતે આરોપી (૧) માધુરી કિશનસિંહ તોમર (૨) વિજયપ્રતાપસિંહ કલહંસ (બંને રહે. ગુરૂકુલ સોસાયટી સરકીટ હાઉસ પાછ શાહીબાગ) એ ભેગા મળી બોગસ ડીગ્રી સર્ટી તથા માર્કશીટ બનાવડાવી ખરા તરીકે ઉપયોગ કરી લખનૌ યુનિવર્સિટીમા ડોક્યુમેંટ વેરીફાઇ કર્યા અંગેનુ સહી સિક્કાવાળુ ખોટુ પ્રમાણપત્ર મેળવી ૫૭ માસ તેટલી નોકરીમા કુલ રૂપિયા ૫,૭૦,૦૦૦/- છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી સી.બી ટંડેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૯૬૮/૧૯

ઈસનપુર: ત્રીલોકચંદ્ર બાબુલાલ ગજ્જર (રહે. ભાગ્યલક્ષ્મી પાર્ક સોસાયટી ગુરૂનાનક હોસ્પિટલની બાજુમા કેડીલા રોડ ઘોડાસર ઈસનપુર) એ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૬/૧૯ કલાક ૦૦/૩૦ થી કલાક ૩/૪૫ વાગ્યા દરમિયાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોનાનુ મંગળસુત્ર કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, સોનાનો દોરો પેડલ સાથે કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, સોનાથી મહેલા કડા નંગ-૨ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, ટાઇટન કંપનીની કડા ઘડીયાળ નંગ-૨ કિંમત રૂપિયા ૨૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૮,૦૦૦/- મત્તાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાચ.જી.માથુકિયા ચલાવે છે.

જીઆઇડીસી વટવા: બાબુભાઇ મેઘજીભાઇ વસાવા (ઉ.વ.૪૫) (રહે. વિનોબાભાવેનગર જીઆઇડીસી વટવા) એ અગમ્ય કારણસર તા.૫/૬/૧૯ કલાક ૦૦/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડની પાઈપ સાથે પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જીઆઇડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આર.શેઠ ચલાવે છે.

કાગડાપીઠ: પાણલબહેન વા/ઓ વસંતભાઇ ગોહેલ (ઉ.વ.૨૮) (રહે. અનમોલ એપાર્ટમેન્ટ ગૌતમનગર ચાર રસ્તા બહેરામપુરા) એ અગમ્ય કારણસર તા.૫/૬/૧૯ બપોરના ૪/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જી.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.